



ગ્રામીણ કૃષિ મૌસમ સેવા
હવામાન આગાહી આધારીત કૃષિ સલાહ બુલેટીન
ઉત્તર સૌરાષ્ટ્ર ખેતખાંબોહવાકીય વિભાગ
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરફડિયા-૩૬૦૦૨૩
તા.૧૬-૦૭-૨૦૨૫ થી તા.૨૦-૦૭-૨૦૨૫



(ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂક્ષીખેતો સંશોધન કેન્દ્ર, જી.ક્ર.યુ., તરફડિયા અને ભારત મૌસમ વિભાગ દ્વારા સંપદ્ધ)

ગુજરાતના ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓનું કૃષિ હવામાન બુલેટીન નં. ૩૧/૨૦૨૫

પાછળા અઠવાડીયાનું રાજકોટનું હવામાન

હવામાન પરિષ્ઠળો	
વરસાદ(મી.મી)	11.2
મહત્વમાન તાપમાન(સે.ગ્રે)	28.9-34.7
લઘુત્વમાન તાપમાન(સે.ગ્રે)	24.1-25.6
ભેજ (%)સવાર	84-89
ભેજ (%)બપોરબાદ	57-83
પવનનીગતિ (કિમી/કલાક)	4.7-7.8

હવામાન આગાહી :પત્રક-૫

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આંબોહવાકીય વિભાગ-હવામાન આગાહી ૨૦-૦૭-૨૦૨૫ સવારના ૮.૩૦ સુધી
તા.૧૬-૦૭-૨૦૨૫ થી ૨૦-૦૭-૨૦૨૫

કૃષિસલાહ :

- ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરફડિયા તરફથી જણાવવામાં આવેછે કે, ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આંબોહવાકીય વિસ્તારના

રાજકોટ :

તારીખ પેરામીટર	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૪	દિવસ-૪	દિવસ-૫
	૧૬-૦૭-૨૦૨૫	૧૭-૦૭-૨૦૨૫	૧૮-૦૭-૨૦૨૫	૧૯-૦૭-૨૦૨૫	૨૦-૦૭-૨૦૨૫
વરસાદ(મી.મી.)	13	7	6	8	25
મહત્વમાન તાપમાન(સે.ગ્રે)	34	36	35	35	33
લઘુત્વમાન (સે.ગ્રે)	25	26	26	26	25
મહત્વમભેજ (%)સવાર	90	85	85	85	90
લઘુત્વમભેજ (%) બપોરબાદ	70	60	60	60	65
પવનની ગતિ (કિમી/કલાક)	18	16	15	14	14
પવનની દિશા(ડીગ્રી)	248	236	233	229	233

વાદળની સ્થિતિ(ઓક્ટો)	6	6	6	6	6
હવામાન આગાહી સારાંશ :					
• રાજકોટ જીલ્લામાં આગામી તા. ૧૬-૦૭-૨૦૨૫ થી તા. ૨૦-૦૭-૨૦૨૫ દરમ્યાન બેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમજ તા. ૧૬ થી ૨૦-જુલાઈ ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.					
• આ સમય ગાળામાં મહત્વમાન તાપમાન દિવસ દરમ્યાન ૩૩-૩૬ ડિગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્તમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૫-૨૬ ડિગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.					
• આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ બેજનું પ્રમાણ અનુક્રમે ૮૫-૯૦ અને ૬૦-૭૦ ટકા રહેશે.					
• પવનની દિશા પશ્ચિમ અને નૈરૂત્યની રહેવાની અને પવનની ઝડપ ૧૪ થી ૧૮ કીમી/કલાક રહેવાની શક્યતા છે					

મોરબી:

તારીખ પેરામીટર	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૪	દિવસ-૪	દિવસ-૫
	૧૬-૦૭-૨૦૨૫	૧૭-૦૭-૨૦૨૫	૧૮-૦૭-૨૦૨૫	૧૯-૦૭-૨૦૨૫	૨૦-૦૭-૨૦૨૫
વરસાદ(મી.મી.)	12	6	6	8	20
મહત્તમ તાપમાન(સે.ગ્રે)	34	36	35	35	33
લઘુત્તમ તાપમાન(સે.ગ્રે)	25	26	26	26	25
મહત્તમ બેજ (%)સવાર	90	85	85	85	90
લઘુત્તમ બેજ (%) બપોરબાદ	70	60	60	60	65
પવનની ગતિ (કિમી/કલાક)	22	18	18	17	17
પવનની દિશા (ડિગ્રી)	245	235	232	228	231
વાદળની સ્થિતિ (ઓક્ટો)	6	6	6	6	6

હવામાન આગાહી સારાંશ :

- મોરબી જીલ્લામાં આગામી તા. ૧૬-૦૭-૨૦૨૫ થી તા. ૨૦-૦૭-૨૦૨૫ દરમ્યાન બેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમજ તા. ૧૬ થી ૨૦-જુલાઈ ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
- આ સમય ગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન **૩૩-૩૬** ડિગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્તમ તાપમાન રાત્રી દરમ્યાન **૨૫-૨૬** ડિગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.
- આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ બેજનું પ્રમાણ અનુક્રમે **૮૫-૯૦** અને **૬૦-૭૦** ટકા રહેશે.
- પવનની દિશા **નૈરૂત્યની** રહેવાની અને પવનની ઝડપ **૧૭** થી **૧૮** કીમી/કલાક રહેવાની શક્યતા છે

દેવભૂમિદ્વારકા :

તારીખ પેરામીટર	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૪	દિવસ-૪	દિવસ-૫
	૧૬-૦૭-૨૦૨૫	૧૭-૦૭-૨૦૨૫	૧૮-૦૭-૨૦૨૫	૧૯-૦૭-૨૦૨૫	૨૦-૦૭-૨૦૨૫
વરસાદ(મી.મી.)	16	15	15	17	20
મહત્તમ તાપમાન(સે.ગ્રે)	33	35	34	34	34
લઘુત્તમ તાપમાન(સે.ગ્રે)	28	28	28	27	27

મહત્વમાન ભેજ (%) સવાર	90	85	85	85	90
લધુત્વમાન ભેજ (%) બપોરખાદ	80	75	75	75	80
પવનની ગતિ(કિમી/કલાક)	22	18	17	18	18
પવનની દિશા (ડીગ્રી)	250	239	232	236	240
વાદળની સ્થિતિ (ઓકટા)	6	6	6	6	6
હવામાન આગાહી સારાંશ :					
• દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આગામી તા. ૧૬-૦૭-૨૦૨૫ થી તા. ૨૦-૦૭-૨૦૨૫ દરમ્યાન ભેજવાણું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમજ તા. ૧૬ થી ૨૦-જુલાઈ ના રોજ છૃટાછવાયા વિસ્તારમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.					
• આ સમય ગાળામાં મહત્વમાન તાપમાન દિવસ દરમ્યાન ૩૩-૩૪ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લધુત્વમાન તાપમાન રાત્રી દરમ્યાન ૨૭-૨૮ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.					
• આ સમયગાળા દરમ્યાન મહત્વમાન અને લધુત્વમાન ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૫-૯૦ અને ૭૫-૮૦ ટકા રહેશે.					
• પવનની દિશા પશ્ચિમ અને નૈરૂત્યની રહેવાની અને પવનની ઝડપ ૧૭ થી ૨૨ કીમી/કલાક રહેવાની શક્યતા છે					

સુરેન્દ્રનગર :

તારીખ પેરામીટર	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૪	દિવસ-૪	દિવસ-૫
	૧૬-૦૭-૨૦૨૫	૧૭-૦૭-૨૦૨૫	૧૮-૦૭-૨૦૨૫	૧૯-૦૭-૨૦૨૫	૨૦-૦૭-૨૦૨૫
વરસાદ (મી.મી.)	14	9	7	9	15
મહત્વમાન તાપમાન (સે.ગ્રે)	34	36	35	35	33
લધુત્વમાન તાપમાન (સે.ગ્રે)	25	26	26	26	25
મહત્વમાન ભેજ (%) સવાર	90	85	85	85	90
લધુત્વમાન ભેજ (%) બપોરખાદ	70	60	60	60	65
પવનની ગતિ(કિમી/કલાક)	19	16	16	15	15
પવનની દિશા (ડીગ્રી)	246	238	234	231	234
વાદળની સ્થિતિ(ઓકટા)	6	6	6	6	6

હવામાન આગાહી સારાંશ :

- સુરેન્દ્રનગર જીલ્લામાં આગામી તા. ૧૬-૦૭-૨૦૨૫ થી તા. ૨૦-૦૭-૨૦૨૫ દરમ્યાન ભેજવાણું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તા. ૧૬ થી ૨૦-જુલાઈ ના રોજ છૃટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
- આ સમય ગાળામાં મહત્વમાન તાપમાન દિવસ દરમ્યાન **૩૩-૩૬** ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લધુત્વમાન તાપમાન રાત્રી દરમ્યાન **૨૫-૨૬** ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.
- આ સમયગાળા દરમ્યાન મહત્વમાન અને લધુત્વમાન ભેજનું પ્રમાણ અનુક્રમે **૮૫-૯૦** અને **૬૦-૭૦** ટકા રહેશે.
- પવનની દિશા **નૈરૂત્યની** રહેવાની અને પવનની ઝડપ **૧૫** થી **૧૮** કીમી/કલાક રહેવાની શક્યતા છે

અમરેલી :

તારીખ પેરામીટર	દિવસ-૧ ૧૬-૦૭-૨૦૨૫	દિવસ-૨ ૧૭-૦૭-૨૦૨૫	દિવસ-૪ ૧૮-૦૭-૨૦૨૫	દિવસ-૪ ૧૯-૦૭-૨૦૨૫	દિવસ-૫ ૨૦-૦૭-૨૦૨૫
વરસાદ (મી.મી.)	15	8	8	10	18
મહત્વમાન (સે.ગ્રે)	35	37	37	37	37
લઘુત્વમાન (સે.ગ્રે)	25	26	26	26	26
મહત્વમાન (%) સવાર	85	80	75	75	75
લઘુત્વમાન (%) બપોરબાદ	70	60	60	60	60
પવનની ગતિ(કિમી/કલાક)	16	14	14	12	13
પવનની દિશા (ડીગ્રી)	252	242	238	234	243
વાદળની સ્થિતિ(ઓક્ટા)	6	6	6	6	6
હવામાન આગાહી સારાંશ :					
<ul style="list-style-type: none"> અમરેલી જીલ્લામાં આગામી તા.૧૬-૦૭-૨૦૨૫ થી તા.૨૦-૦૭-૨૦૨૫ દરમ્યાન ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમજ તા. ૧૬ થી ૨૦-જુલાઈ ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહત્વમાન રાત્રી દરમ્યાન ૩૫-૩૭ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્વમાન રાત્રી દરમ્યાન ૨૫-૨૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્વમાન અને લઘુત્વમાન ભેજનું પ્રમાણ અનુકૂળ ૭૫-૮૫ અને ૬૦-૭૦ ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમ અને નૈરૂત્યની રહેવાની અને પવનની ઝડપ ૧૨ થી ૧૬ કિમી/કલાક રહેવાની શક્યતા છે 					

જામનગર :

તારીખ પેરામીટર	દિવસ-૧ ૧૬-૦૭-૨૦૨૫	દિવસ-૨ ૧૭-૦૭-૨૦૨૫	દિવસ-૪ ૧૮-૦૭-૨૦૨૫	દિવસ-૪ ૧૯-૦૭-૨૦૨૫	દિવસ-૫ ૨૦-૦૭-૨૦૨૫
વરસાદ (મી.મી.)	13	8	7	8	25
મહત્વમાન (સે.ગ્રે)	33	35	34	34	33
લઘુત્વમાન (સે.ગ્રે)	28	28	28	28	27
મહત્વમાન (%) સવાર	85	75	75	75	80
લઘુત્વમાન (%) બપોરબાદ	75	65	70	70	75
પવનની ગતિ(કિમી/કલાક)	21	17	17	16	17
પવનની દિશા (ડીગ્રી)	247	236	229	229	235
વાદળની સ્થિતિ(ઓક્ટા)	6	6	6	6	6

હવામાન આગાહી સારાંશ :

- જામનગર જીલ્લામાં આગામી તા.૧૬-૦૭-૨૦૨૫ થી તા.૨૦-૦૭-૨૦૨૫ દરમ્યાન ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમજ તા. ૧૬ થી ૨૦-જુલાઈ ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
- આ સમય ગાળામાં મહત્વમાન રાત્રી દરમ્યાન **૩૩-૩૪** ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્વમાન રાત્રી દરમ્યાન **૨૫-૨૬** ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

તાપમાન રાત્રી દરમ્યાન ૨૭-૨૮ ડિગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

- આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુતમ બેજનું પ્રમાણ અનુક્રમે ૭૫-૮૫ અને ૬૫-૭૫ ટકા રહેશે.
- પવનની દિશા નૈસુન્યની રહેવાની અને પવનની ઝડપ ૧૬ થી ૨૧ કીમી/કલાક રહેવાની શક્યતા છે

<p>હવામાન ચેતવણી : નથી</p> <p>હવામાન ચેતવણીની ફૂષિ પર સંભવિત અસર અને તે અનુસંધાને ફૂષિ સલાહ : નથી</p> <p>સામાન્ય ફૂષિ સલાહ :</p> <ul style="list-style-type: none"> હાલ ઉભા પાકમાં વરાપે આંતર એડ કરવી જેથી જમીનમાં બેજ જળવાય રહે, હવાની અવાર જવર રહે અને નિદામણનો નાશ થાય અને પાકનો વૃદ્ધિ વિકાસ સારો થાય. સતત વરસાદને કારણે પાણી લાગી ગયેલ પાકમાં એમોનિયમ સલેક્ટ અને મ્યુરેટ ઓફ પોટાશ આપવું. ધરું તૈયાર હોય તો મરચી, રોગણ કોષી અને ફ્લાવરની ફેર રોપણી કરવી. <p>હવામાન આગોતરો વરતારો : તા. ૨૦ થી ૨૫-જુલાઈ-૨૦૨૫ દરમ્યાન બેજવાળું અને વાદળણાયું હવામાન અને હળવા વરસાદ રહેવાની સંભાવના છે.</p> <ul style="list-style-type: none"> મોબાઇલ સેટેશન : ઉભા પાકમાં વરાપે આંતરએડ અને નિદામણ કરવું અને ભલામણ મુજબ નાઈટ્રોજનનો પૂર્તિ ડોઝ આપવો. 			
			ફૂષિસલાહ (૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી ભલામણ કરેલ દવા છાંટવી)
મુખ્યપાક	પાક અવસ્થા	રોગ/જીવાત/જાત	ફૂષિસલાહ (૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી ભલામણ કરેલ દવા છાંટવી)
ચોમાસું મગફળી	<p>કૂલ શરૂઆત</p> <p>મોલો મશી</p> <p>નિદામણ</p>	<p>• પીળાશ</p>	<ul style="list-style-type: none"> વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. પીળી પડેલ મગફળીમાં વરસાદનો રાઉન્ડ પૂરો થયા પછી એમોનિયમ સલેક્ટ અને મ્યુરેટ ઓફ પોટાશ દરેક ૩૦ કી.ગ્રા.ડે. આપવું. તેમજ વરાપે હીરાકસી ૧૫૦ ગ્રામ અને લીબુના કૂલ ૧૫ ગ્રામ ૧ પમ્પમાં નાખીને છંટકાવ કરવો. સરકોસ્પોરા કૂગનો પાનના ટપકાનો રોગ લાગે નહિ તે માટે ટેબ્યુંકોનાઝોલ ૧૮.૩ ૧૫ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. આગોતરી મગફળીમાં મોલોમશી નો ઉપદ્રવ વધુ હોય તો ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ ટકા ૫ મી.લી. ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છાંટવી. મગફળીમાં વરાપે આંતરએડ અને નિદામણ કરવું.

કપાસ	વૃદ્ધિ/ ડાળી	• તડતડીયા/ લીલી પોપટી	<ul style="list-style-type: none"> કપાસમાં તડતડીયાના નિયંત્રણ માટે એસીફેટ ૭૫ ટકા પાવડર ૨૫ ગ્રામ અને ૧૫૦૦ પીપીએમ લીમડાનું તેલ ૪૦ મીલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. • વરસાદનો રાઉન્ડ પૂરો થયા પછી ૩૦-૪૦ દિવસના કપાસમાં યુરીયા અને એમોનિયમ સલેફ્ટ અને મ્યુરેટ ઓફ પોટાશ દરેક ૩૦ કી.ગ્રા./હે. પુરતી ખાતર તરીકે આપવું . • અલ્ટરનેરીએચા ફૂગનો રોગ લાગે નહિ તે માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. • કપાસમાં વરાપે આંતરખેડ અને નિદામણ કરવું.
તેલ	વૃદ્ધિ	-	<ul style="list-style-type: none"> • તલમાં વરાપે આંતરખેડ અને નિદામણ કરવું. • તલમાં સમયસર પારવણી કરીને વાવેતર બાદ ૩૦ દિવસે યુરીયા પણ કી.ગ્રા./હે આપવું. • અલ્ટરનેરાએચા ફૂગનો રોગ લાગે નહિ તે માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીઅતા પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
બાજરી	ફૂટ	--	<ul style="list-style-type: none"> • બાજરીમાં વરાપે આંતરખેડ અને નિદામણ કરવું. • બાજરીમાં સમયસર પારવણી કરીને વાવેતર બાદ ૩૦ દિવસે યુરીયા ૮૭ કી.ગ્રા./હે આપવું.
મગ	વૃદ્ધિ	-	<ul style="list-style-type: none"> • વરાપે આંતરખેડ અને નિદામણ કરવું.
અડદ	વૃદ્ધિ	-	<ul style="list-style-type: none"> • વરાપે આંતરખેડ અને નિદામણ કરવું.
ચોળી	વૃદ્ધિ	-	<ul style="list-style-type: none"> • વરાપે આંતરખેડ અને નિદામણ કરવું.
તુવેર	વાવેતર	તુવેર માટે બીડીએન-૨, ગુજરાત તુવેર - ૧૦૦, ગુજરાત તુવેર હાઇબ્રીડ-૧,	<ul style="list-style-type: none"> • જુવાઈ માસના અંત સુધીમાં વાવણી લાયક વરસાદ થયે તુવેરનું વાવેતર પુર્ણ કરવું. • તુવેર ના પાકને વાવેતર સમયે ડી.એ.પી. ૮૭ કી.ગ્રા. /હે. પાયામાં આપવું. • વાવેતર સમયે તુવેરના બીજને રાઇઝોફીયમ અને ફોસ્ફરસ સોલ્યુન્ઝિલાઝીગ બેકટેરિયાનો પટ આપવો.
ઘાસચારાના પાક	વૃદ્ધિ	-	<ul style="list-style-type: none"> • જુવારના પાકમાં સાંઠાની માખીનો ઉપદ્રવ ના થાય તે માટે સતત નિરિક્ષણ કરતા રહેવું, જો ઉપદ્રવ વધુ હોય તો ઇમીડાક્લોપ્રોડ ૧૭.૮ ટકા એસ.એલ. ૫ મિ.લી./૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

			<ul style="list-style-type: none"> મકાઈના પાકમાં ફોલ આર્મી વર્મનો ઉપદ્રવ ના થાય તે માટે માટે સતત નિરિક્ષણ કરતા રહેવું, જો ઉપદ્રવ વધુ હોય તો રીનાક્ષીપાયર ૨૦ એસ.સી. ૪ મિ.લી./૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
ભીડા	ફૂલ/ફળ	સફેદમાખી, પાનકથીરી	<ul style="list-style-type: none"> સફેદ માખીના નિયંત્રણ માટે લીભોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીભોળીના મીજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી અને ઈમીડાક્લોપ્રીડ ૩૦.૫ ટકા ૪ મિલી અથવા એસીટેમાપ્રીડ ૨૦ ટકા ૫ ગ્રામ દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને હવામાન ચોખ્યું હોય ત્યારે છંટકાવ કરવો. ગરમ બેજવાળા હવામાનના કારણે ભીડામાં જો પાન કથીરીનો ઉપદ્રવ હોય તો ઇથીઓન ૩૦ મિલી પ્રતિ પંપ હવામાન ચોખ્યું હોય ત્યારે છંટકાવ કરવો. ભીડાની શીંગની વીણી બાદ ૨૦ કી.ગ્રા./લેક્ટર યુરીયા ખાતર આપવું.
તુરીયા દૂધી ગલકા કારેલા ગુવાર કાકડી તરબુદ્ધ	વૃધ્ધિ વિકાસ/ફૂલ ફળ	સફેદમાખી તળણારો	<ul style="list-style-type: none"> વધારાના વરસાદી પાણીના નિકાલની કાળજી રાખવી. વેલાવાળા શાકભાજુમાં સફેદ માખીના નિયંત્રણ માટે લીભોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીભોળીના મીજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી અને ઈમીડાક્લોપ્રીડ ૩૦.૫ ટકા ૪ મિલી અથવા એસીટેમાપ્રીડ ૨૦ ટકા ૫ ગ્રામ દવાને ૧૦ લીટરપાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. વેલાવાળા શાકભાજુમાં તળણારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૪૦ ગ્રામ પ્રતિ પંપમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
રીગણી	ફૂલ/ફળ	સફેદમાખી કુંખઅને ફળકોરોખાનારાઇ યળ	<ul style="list-style-type: none"> રીગણીમાં સફેદ માખીના નિયંત્રણ માટે લીભોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીભોળીના મીજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી અને ડાયફેન્થાયુરોન ૫૦ ટકા વે.પા. ૧૬ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૫ મિ.લી. દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. ફળ અને ડોકાની ઈયળોનો ઉપદ્રવ હોય તો નુકશાન પામેલ ફળ અને ડોકા તોડીને જમીનમાં દાંટી દેવા અને ક્લોરાન્ટાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. (રીનાક્ષીપાયર) દવા ૩ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને વરાપે છંટકાવ કરવો.
મરચી	વૃધ્ધિ/ફૂલ/ફળ	થ્રીપ્સ,સફેદમાખી	<ul style="list-style-type: none"> પ્રોફેનોફોસ ૨૦ મીલી અને લીભોળીનું તેલ ૫૦ મિલી અથવા લીભોળીના મીજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી ૧૦લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. થ્રીપ્સનો વધુ ઉપદ્રવ હોય

		પાન કથીરી	<p>તો સ્પીનોસાદ અથવા સ્પીનેટોરમ દવા પ મિલી. પ્રતિ પંપ વરાપે છાંટવી.</p> <ul style="list-style-type: none"> ➤ મરચીમાં જો પાનકથીરીનો ઉપદ્રવ હોય તો ઈથીઓન ૫૦ ટકા ઇસી ૧૫ મિલી અથવા પ્રોપરગાઈટ ૫૭ ઇ.સી. ૧૦ મિલી પ્રતિ ૧૦ લીટરપાણીમાં મિશ્ર કરીને વરાપે છંટકાવ કરવો. <p>વાયરસના કારણે કોકડાયેલ મરચીના છોડ ઉપાડીને જમીનમાં ઢાંટી દેવા અને ઉભા પાકમાં ઈમીડાકલોપ્રીડ ૩ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને વરાપે છંટકાવ કરવો.</p>
લીબુ	ફળનો વિકાસ	<p>ટેકા આપવા</p> <p>પાનકોરીયુ</p> <p>કથીરી→ </p> <p>બળીઆ ટપકા અને ગુંદરિયો</p>	<ul style="list-style-type: none"> • લીબુના ઝાડ બીપોરજોય વાવાજોડા નાં કારણે આડા/ત્રાંસા થય ગયેલ હોય તો તેને લાકડાના ટેકા આપી સીધા કરવા. • પાનકોરીયુના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૩૦.૫ ટકા ૫ મી.લી. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરીને વરાપે છાંટવી. • લીબુડીમાં જો પાનકથીરીનો ઉપદ્રવ હોય તો પ્રોપરગાઈટ ૫૭ ઇ.સી. ૧૦ મિલી પ્રતિ ૧૦ લીટરપાણીમાં મિશ્ર કરીને વરાપે છંટકાવ કરવો. • લીબુમાં બળીઆ ટપકા અને ગુંદરિયો રોગના નિયંત્રણ માટે કોપર ઓક્ષિ ક્લોરાઈડ ૪૦ ગ્રામ અને સ્ટ્રેપટોમાયસીન સલ્ફેટ ૧ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને વરાપે છંટકાવ કરવો.
પશુ/મરધા		વરસાદી હવામાનના કારણે પશુઓને શેડમાં રાખવા. ઈતરડીના નિયંત્રણ માટે ડેલ્ટામેથ્રીન અથવા એમીટ્રાઝ ૨ મિ.લિ. એક લિટર પાણીમાં નાખીને છાંટવી. વિટામીન એ તથા ડી પુરકો આપવા. કરમિયાની દવા, ટી.બી. તથા જે.ડી ના રોગની પરખ કરાવવી. વરસાદના સમયે પશુઓને સુરક્ષીત જગ્યાએ રાખવા. યોમાસા દરમ્યાન જાનવરોને રહેઠાળની જગ્યાની વ્યવસ્થિત સફાઈ તેમજ માખીઓના ઉપદ્રવથી બચવા ફિનાઈલ છાંટવું. દુધાળા પ્રાણીઓને નિયમિત ૧ કિલ્વો ફીડ + ૫૦ ગ્રામ ઘનીજ તત્વોનું મિશ્રણ પ્રતિ ૨ લીટર દુધની ઊપજના પ્રમાણમાં આપવું. તેમજ લીલું ધાસ + સૂકું ધાસ + ઘનીજ તત્વો ખોરાકમાં આપવા. દુધાળા પશુઓના આઉને ઝીક ઓક્સાઈડ અથવા બોરિક પાવડરથી સાફ કરવું. ખુલ્લામાં રાખેલ ધાસસારો વરસાદથી બગડે નહિ તે માટે જરૂરી પગલા ભરવા.	
નોંધ	નીચેની એપ ડાઉનલોડ કરો		

- મૌસમ એપ જીવા પ્રમાણે હવામાન આગાહી અને ચેતવણી માટે.
- મેધદૂત એપ હવામાન આધારિત ફુષિસલાઇ બુલેટીન માટે.
- દામીની એપ વરસાથી વીજળીની ચેતવણી માટે.

જા.નં.જુફ્યુ/સૂ.પે./એગ્રોમેટ/બુલેટીન/
તરધડીયા(રાજકોટ), તારીખ: ૧૫/૦૭/૨૦૨૫,


તંત્રીશ્રી/દાયરેકટરશ્રી,
રાજકોટ,

ઉપરોક્ત માહિતી આપના દૈનિક સમાચાર પત્રોમાં, રેડીયોમાં ગામના ચોરાના કાર્યક્રમમાં તથા ટીવીના ગ્રામ્ય કાર્યક્રમમાં વિનામૂલ્યે પ્રસિધ્ય કરાવવા નામ્ન વિનતી છે. સહકારની અપેક્ષા સહ આભાર.
ટેકનીકલ ઓફિસર

સુકીએતી સંશોધન કેન્દ્ર
જુનાગઢ ફુષિ યુનિવર્સિટી
તરધડીયા

NOAA/VIIRS/BLENDED NDVI Composite ending on Week no 27 (02.07.2025 to 08.07.2025) over Agricultural region

Gujarat





Gramin Krushi Mausam Seva
Main Dry Farming Research Station
Junagadh Agricultural University
AMFU-Targhadia (Rajkot) - 360 023



Agromet Advisory Service bulletin No.31 for North Saurashtra districts (Gujarat)

(Issued jointly by AMFU-DFRS, J.A.U., Targhadia (Rajkot) & India Meteorological Department)

(Period for 16 to 20-July-2025)

Significant past weather for the preceding week of Rajkot

Rainfall (mm)	11.2
Maximum temperature (°C)	28.9-34.7
Minimum temperature (°C)	24.1-25.6
Relative Humidity (%) I	84-89
Relative Humidity (%) II	57-83
Wind speed (Kmph)	4.7-7.8

Weather forecast until 08-30 hrs. of 20/07/2025

(1) RAJKOT DISTRICT:

	16/07/2025	17/07/2025	18/07/2025	19/07/2025	20/07/2025
Rainfall (mm)	13	7	6	8	25
Max.Temp.(°C)	34	36	35	35	33
Min.Temp.(°C)	25	26	26	26	25
RH-I (%)	90	85	85	85	90
RH-II (%)	70	60	60	60	65
Wind Speed (kmph)	18	16	15	14	14
Wind Direction(deg.)	248	236	233	229	233
Total CC (octa)	6	6	6	6	6

Forecast Summary: As per the forecast received from India Meteorological Department

- **General weather:** Humid and generally cloudy weather forecasted for next five days.
- **Rainfall:** Light to moderate rainfall at isolated place forecasted during 16 to 20-July -2025.
- **Temperature:** Maximum and minimum temperature likely to be in range of 33-36°C and 25-26°C, respectively.
- **Relative Humidity:** The RH-I and RH-II is likely to be in the range of 85-90% & 60-70, respectively.
- **Wind Direction and Speed:** Direction and speed of wind is likely to be W, SW and 14-18 km/h, respectively.

(2) MORBI DISTRICT:

	16/07/2025	17/07/2025	18/07/2025	19/07/2025	20/07/2025
Rainfall (mm)	12	6	6	8	20
Max.Temp.(°C)	34	36	35	35	33
Min.Temp.(°C)	25	26	26	26	25
RH-I (%)	90	85	85	85	90
RH-II (%)	70	60	60	60	65
Wind Speed (kmph)	22	18	18	17	17
Wind Direction(deg.)	245	235	232	228	231
Total CC (octa)	6	6	6	6	6

Forecast Summary: As per the forecast received from India Meteorological Department

- **General weather:** Humid and generally cloudy weather forecasted for next five days.
- **Rainfall:** Light to moderate rainfall at isolated place forecasted during 16 to 20-July -2025.
- **Temperature:** Maximum and minimum temperature likely to be in range of 33-36°C and 25-26°C, respectively.
- **Relative Humidity:** The RH-I and RH-II is likely to be in the range of 85-90% & 60-70, respectively.
- **Wind Direction and Speed:** Direction and speed of wind is likely to be SW and 17-22 km/h, respectively.

(3) DEVBHUMI DWARKA DISTRICT:

	16/07/2025	17/07/2025	18/07/2025	19/07/2025	20/07/2025
Rainfall (mm)	16	15	15	17	20
Max.Temp.(°C)	33	35	34	34	34
Min.Temp.(°C)	28	28	28	27	27
RH-I (%)	90	85	85	85	90
RH-II (%)	80	75	75	75	80
Wind Speed (kmph)	22	18	17	18	18
Wind Direction(deg.)	250	239	232	236	240
Total CC (octa)	6	6	6	6	6

Forecast Summary: As per the forecast received from India Meteorological Department

- **General weather:** Humid and generally cloudy weather forecasted for next five days.
- **Rainfall:** Light to moderate rainfall at isolated place forecasted during 16 to 20-July -2025.
- **Temperature:** Maximum and minimum temperature likely to be in range of 33-35°C and 27-28°C, respectively.
- **Relative Humidity:** The RH-I and RH-II is likely to be in the range of 85-90% & 75-80, respectively.

Wind Direction and Speed: Direction and speed of wind is likely to be W, SW and 17-22 km/h, respectively.

(4) SURENDRANAGAR DISTRICT:

	16/07/2025	17/07/2025	18/07/2025	19/07/2025	20/07/2025
Rainfall (mm)	14	9	7	9	15
Max.Temp.(°C)	34	36	35	35	33

Min.Temp.(°C)	25	26	26	26	25
RH-I (%)	90	85	85	85	90
RH-II (%)	70	60	60	60	65
Wind Speed (kmph)	19	16	16	15	15
Wind Direction(deg.)	246	238	234	231	234
Total CC (octa)	6	6	6	6	6

Forecast Summary: As per the forecast received from India Meteorological Department

- **General weather:** Humid and generally cloudy weather forecasted for next five days.
- **Rainfall:** Light rainfall at isolated place forecasted during 16 to 20-July -2025.
- **Temperature:** Maximum and minimum temperature likely to be in range of 33-36°C and 25-26°C, respectively.
- **Relative Humidity:** The RH-I and RH-II is likely to be in the range of 85-90% & 60-70%, respectively.
- **Wind Direction and Speed:** Direction and speed of wind is likely to be SW and 15-19 km/h, respectively.

(5) AMRELI DISTRICT:

	16/07/2025	17/07/2025	18/07/2025	19/07/2025	20/07/2025
Rainfall (mm)	15	8	8	10	18
Max.Temp.(°C)	35	37	37	37	37
Min.Temp.(°C)	25	26	26	26	26
RH-I (%)	85	80	75	75	75
RH-II (%)	70	60	60	60	60
Wind Speed (kmph)	16	14	14	12	13
Wind Direction(deg.)	252	242	238	234	243
Total CC (octa)	6	6	6	6	6

Forecast Summary: As per the forecast received from India Meteorological Department

- **General weather:** Humid and generally cloudy weather forecasted for next five days.
- **Rainfall:** Light to moderate rainfall at isolated place forecasted during 16 to 20-July -2025.
- **Temperature:** Maximum and minimum temperature likely to be in range of 35-37°C and 25-26°C, respectively.
- **Relative Humidity:** The RH-I and RH-II is likely to be in the range of 75-85% & 60-70%, respectively.

Wind Direction and Speed: Direction and speed of wind is likely to be W, SW and 12-16 km/h, respectively.

(6) JAMNAGAR DISTRICT:

	16/07/2025	17/07/2025	18/07/2025	19/07/2025	20/07/2025
Rainfall (mm)	13	8	7	8	25
Max.Temp.(°C)	33	35	34	34	33
Min.Temp.(°C)	28	28	28	28	27
RH-I (%)	85	75	75	75	80
RH-II (%)	75	65	70	70	75
Wind Speed (kmph)	21	17	17	16	17
Wind Direction(deg.)	247	236	229	229	235

Total CC (octa)	6	6	6	6	6
Forecast Summary: As per the forecast received from India Meteorological Department					
• General weather: Humid and generally cloudy weather forecasted for next five days.					
• Rainfall: Light to moderate rainfall at isolated place forecasted during 16 to 20-July -2025.					
• Temperature: Maximum and minimum temperature likely to be in range of 33-35°C and 27-28°C, respectively.					
• Relative Humidity: The RH-I and RH-II is likely to be in the range of 75-85% & 65-75, respectively.					
Wind Direction and Speed: Direction and speed of wind is likely to be SW and 16-21 km/h, respectively.					

Agro meteorological Advisories:

	<p style="color: red;">Weather Warning : Nil</p> <ul style="list-style-type: none"> • Likely impacts of weather warnings on Agriculture and associated Agromet advisories : Nil 					
General Advisory						
<ul style="list-style-type: none"> • Carry out interculturing and weeding under wapsa condition for better growth. • Due to excess rainfall and continuous cloudy weather apply Ammonium Sulphate and potash fertilizer each to cotton crop. • Carry out transplanting of mature seedlings of Chili, Brinjal, Cabbage and cauliflower. 						
<ul style="list-style-type: none"> • Weather outlook for subsequent week: As per extended range forecast humid, Generally cloudy and Light rainfall likely to observe during 20 to 25-July-2025. 						
<ul style="list-style-type: none"> • Sms : Carry out interculturing and weeding under wapsa condition and apply recommended supplementary dose of nitrogenous fertilizer. 		Advisory				
Crops	Stage	Insect/Pest/ Variety				
Kharif groundnut	Branching and Flowering initiation	<ul style="list-style-type: none"> • Yellowing • Weed • Aphid 	<ul style="list-style-type: none"> • Apply Ammonium sulphate fertilizer 30 kg/ha for correction of yellowing. • Spray ferrous sulfate 100 gram & citric acid 10 gram/10 litre of water to cure yellowing of groundnut crop. • Carry out interculturing and weeding under vapsa condition. • Under scarcity of labour spray ready mix of Sodium Acifluorfen 16.5% + Clodinafop Propargyl 8% EC 20 ml in 10 litre of water for control of broad and narrow leaves weed in 			

			<p>groundnut.</p> <ul style="list-style-type: none"> • To prevent leaf spot disease infestation spray Tebuconazole 18.3 % SC 15 in 10 liters of water as precautionary measure under clear sky. <p>Monitor groundnut crop for infestation of aphids. If infestation found above ETL, then spray Imidacloprid 17.8 % EC 5 ml in 10 litre of water.</p>
Cotton	Branching	Jassids	<ul style="list-style-type: none"> • Under present weather condition jassids infestation observed in cotton, at above ETL spray acephate 75 % SP 15 gm with 1500 ppm neem oil 40 ml /10 litre of water. • Carry out intercropping to remove weeds and to prevent evaporation losses, where sowing of kharif crops is done in cotton crop. • Apply supplementary dose of 20 kg/ha urea, Ammonium sulphate and Murate of Potash each to cotton at 25-30 DAS under clear sky. • To prevent alternaria blight disease infestation spray Mencozeb 75 % WP 27 gm in 10 liters of water as precautionary measure under clear sky.
Sesame	Growth	-	<ul style="list-style-type: none"> • Carry out inter culturing and weeding at vapsa condition. • Apply supplementary dose of nitrogen(Urea 54 kg/ha) to sesame at 30 DAS under clear sky.
Pearl millet	Tillering	-.	<ul style="list-style-type: none"> • Carry out inter culturing and weeding at vapsa condition.. • Apply supplementary dose of 87 kg/ha urea to pearl millet at tillering stage under clear sky.
Green gram	Growth/branching	-.	Carry out inter culturing and weeding at vapsa condition.
Black gram	Growth/branching	-.	Carry out inter culturing and weeding at vapsa condition.
Cow pea	Growth/branching	-.	Carry out inter culturing and weeding at vapsa condition.
Pigeon pea	Sowing in July end	BDN-2, GT-100, GJP-1, Vaishali	<ul style="list-style-type: none"> • Apply 87 kg DAP/ha as basal dose. • Sowing of pigeon pea may be done up to end of July. Farmers are advised to procure good quality seeds from certified sources. • Before sowing pigeon pea seeds should be treated with crop specific Rhizobium culture and Phosphate Solubilizing Bacteria.

Castor	Sowing	GC-3,GCH-4, 7, 9	<ul style="list-style-type: none"> • Procure good quality of seeds for kharif sowing.
Fodder Sorghum & Maize	Growth	-	<ul style="list-style-type: none"> • Continuously monitor the sorghum crop for shoot fly infestation, if infestation observe above ETL spray imidacloprid 17.8 SL 5 ml/10 litre of water.
Ladyfinger	Flowering/fruiting	White flies & Mites	<ul style="list-style-type: none"> • Under clear weather spray 500 ml of 5 % neem seed extract or neem seed oil 50 ml with withacetamiprid 20 % SP@ 5.0 gm or imidacloprid 30.5 SC4 ml/10 lit of water for white flies control in okra. • Constant monitoring of ladyfinger crop against attack of mite is advised. If population is found more, then spraying of Ethion @ 1.5-2 ml/litre of water is advised. • After harvesting of mature okra application of urea @ 20 kg/ acre should be done.
Ridge gourd	Flowering/fruiting	White fly Downy mildew	<ul style="list-style-type: none"> • In all broad leafy vegetables whitefly infestation observed above ETL. Spray 500 ml of 5 % neem seed extract or neem seed oil 50 ml with acetamiprid 20 % SP@ 5.0 gm or imidacloprid 30.5 SC4 ml/10 lit of water for whiteflies control.
Bottle gourd			<ul style="list-style-type: none"> • If mite population is found more, then spraying of Ethion @ 1.5-2 ml/litre of water for the control of Mites in cucurbiteous .
Sponge guard			<ul style="list-style-type: none"> • For the control of downy mildew spray mencozeb 40g/pump.
Bitter guard			
Cluster bean			
Cucumber			
Water melon			
Brinjal	Flowering/fruiting	White fly→ Shoot &Fruit borer	<ul style="list-style-type: none"> • To minimize population of whitefly, Spray 500 ml of 5 % neem seed extract or neem oil 50 ml with Difenthiuron 50 WP @ 16 gm or Trizophos 40 EC 25 ml / 10 lit of water. • In brinjal, monitoring of borers by using pheromone traps 4-6 per acre is advised. For control of shoot and fruit borer in brinjal, infested fruits and shoots should be collected and buried into the soil. If fruits and shoot borer population is above ETL then spraying of chlorantraniliprole18.5 % SC 3.0 ml /10 litre of water is advised.

Chili	Flowering & fruiting	Thrips →  Mites Viral leaf curling	<ul style="list-style-type: none"> For control of thrips, spray Profenofos 20 ml with 500 m of 5 % neem seed extract or neem seed oil 50 ml in 10 litres of water. In case of severe attack, spray Spinosad or Spinetoram 3 ml per 10 liter of water. If infestation of mite observed in chilli, then spray Ethion 50 EC 15 ml or Propargite 57 % EC @ 10 ml/ 10 litre of water under clear weather. Under weather conditions, rouging of viral infested plants should be done in chilli. Infected plants should be uprooted and buried in the soil. After rouging, spraying of Imidacloprid @ 3 ml per 10 litre of water is advised to control the vector.
Lemon	Fruit development	Citrus canker Leaf minor	<ul style="list-style-type: none"> Spray copper oxychloride 40 gm or streptocyclie 1.5 gm in 10 liters of water for the control of citrus canker in lemon under clear weather. Spray Quinalphos 20 ml in 10 liters of water for control of leaf minor.
Livestock & poultry 	Keep animal in shed during rainfall hours. Spray Deltamethrin or Amitraz 2 ml/litre of water for the control of tick. Deworming, T.B. and J.D. Testing should be done. Provide 6-8 kg good quality dry roughage with 15-20 kg green fodder to the animals. For milch animals, regularly follow schedule of 1 kg feed + 50 g mineral mixture per 2 liters of milk yield. Feed animals with a mixture of green grass + hay + minerals + dry feed. Ensure regarding vaccination of animals for different diseases in rainy season. Spray phenyl in the animal shed to avoid fly's and mosquitoes. Udder of milking animals must be properly clean with zinc oxide or boric powder. Also give deworming tablet to younger animals. For control of ticks and mites spray Deltamethrin or Amitral 2 ml/liter of water. Keep fodder in safe place to avoid spoilage due to rainfall.		
Note	<p>Kindly download</p> <ul style="list-style-type: none"> MAUSAM App for location specific forecast & warning. MEGHDOOT App for Agromet advisory. DAMINI App for lighting warning. 		

Technical Officer, GKMS Unit, DFRS, JAU, Targhadia.

**NOAA/VIIRS/BLENDED NDVI Composite ending on Week no 27
(02.07.2025 to 08.07.2025) over Agricultural region**

Gujarat

